

Dammar Daak 4 Song Lyrics

He aavo aavo
Mari jahubai zhopdi aavo
He aavo aavo
Mari hadkaibai meldi aavo

Maa na pava vage maa na bhuva dhune
Maa na pagla pade tade dukhda
Maa na pava vage maa na bhuva dhune
Maa na pagla pade tade dukhda

Maa ni aankh no prabhav
Maa no mamta kero hath fare mathe
Bhagi jaay badha bhutda

Maadi vage tara daak tara bad kare had
Aave tu to thai jay bhag ujada
Maadi vage tara daak tara bad kare had
Aave tu to thai jay bhag ujada

He chotila vadi
He bhaguda vadi

He chotila vadi bhaguda vadi
Chotila vadi bhaguda vadi aavo ramva re

Pavariya tara aaya
Daakla jabra vagya
Are joravar tara aaya

Chand mund hannar madi na zalar no zankar
Niche padela ne ugata kare aevi mari mavdi no khamkaar
Chamkar

Made etla puche gano etala khute
Bhano etla sukhe pade etala dube
Ne jat chapti kam thay puru jo naam taru mukhe

Mari sachi re sat
Aa pag ne lagi jo garba ni lat

Kadiya bhil ni devi atali araj
Ke sat buddhi tu api de jat

Tane rakhu agad to pachi mane koni vaat
To man muki ne tu ram aaj
Aeva vagadu dammar daak ke nastik ne ade pavan

Tu vhali chhe tara khota shogand na khavay
Tu vhali chhe tara khota shogand na khavay

Aaj chok puraya mavdi
Aaje ramva aavo mavdi
Aaj chok puraya mavdi
Aaje ramva aavo mavdi
Bharatlyrics.com
Aavo ne aavo mavdi

Tara pavariya re aaya ramva vhela aavo
Tara jagariya aaj aaya ramva vhela aavo

Madi tu rakhe najar jo prem ni to bhangе kapra dukh
Ae het na dariyavadi jo mare tu phoonk to made tadhak ne
Tari aa hoonf jo re ne hare to lage che dur
Aa dukh ni bad bad bad farti damario

Ne me jyare jyare karyo saad kanku kero haath te dhariyo
Mahisasur no vadh te karyo
Tu mara kud ni janeta raksha kar
Betho chu tane hu vinvu ke have aavi ne chok ma pagla kar

Rakh kahal ne jaho jalali tu rakhe
Tara choru nu je kare khotu aene aankhe tu rakhe
Ne aakho ne aakho tu chandmund hannari

Mari ranchandi chamund
Tu thabad thabad kre to aavi jay mithadi ungh
Tu vhal no dariyo
Mari mavladi tane jova aatur aakhu kud
Ne vage che pava tu aavine jhoom jhoom jhoom

Maa na pava vage maa na bhuva dhune

Maa na pagla pade tade dukhda
 Maa na pava vage maa na bhuva dhune
 Maa na pagla pade tade dukhda

Maa ni aankh no prabhav
 Maa no mamta kero hath fare mathe
 Bhagi jaay badha bhutda

Maadi vage tara daak tara bad kare had
 Aave tu to thai jay bhag ujada.

More Lyrics from [Aghori Muzik](#)

ડમ્મર ડાક 4 Lyrics in Gujarati

હે આવો આવો
 મારી જહુબઈ ઝોપડી આવો
 હે આવો આવો
 મારી હડકઈબઈ મેલડી આવો

માંના પાવા વાગે માંના ભુવા ધૂને
 માંના પગલાં પડે ટળે દુખડા
 માંના પાવા વાગે માંના ભુવા ધૂને
 માંના પગલાં પડે ટળે દુખડા

માંની આંખનો પ્રભાવ
 માંનો મમતા ફેરો હાથ ફેરે માથે
 ભાગી જાય બધા ભૂતડા

માડી વાગે તારા ડાક તારા બાળ ફરે હાદ
 આવે તું તો થઇ જાય ભાગ ઉજળા
 માડી વાગે તારા ડાક તારા બાળ ફરે હાદ
 આવે તું તો થઇ જાય ભાગ ઉજળા

હે ચોટીલા વાળી
 હે ભગુડા વાળી

હે ચોટીલા વાળી ભગુડા વાળી
 ચોટીલા વાળી ભગુડા વાળી આવો રમવા રે

માંના પાવરીયા તારા આયા
 ડાકલા જબરા વાગ્યા
 અરે જોરાવર તારા આયા

BHARAT
 lyrics

ચંડ મૂંડ હુણનાર માડીના ઝાલરનો ઝણકાર
નીચે પડેલાને ઉગતા કરે એવી મારી માવડીનો ખમકાર
ચમકાર

મળે એટલા પૂછે ગણો એટલા ખૂટે
ભારતલીરીકસ.કોમ
ભનો એટલા સુખે પડે એટલા ડૂબે
ને જટ ચપટી કામ થાય પૂરું જો નામ તારું મુખે

મારી સાચી રે સત
આ પગને લાગી જો ગરબાની લત
કાળીયા ભીલની દેવી આટલી અરજ
કે સત બુદ્ધિ તું આપી દે જટ

તને રાખું આગળ તો પછી મને કોની વાટ
તો મન મૂકી ને તું રમ આજ
એવા વગાડું ડમર ડાક કે નાસ્તિક ને અડે પવન

તું વહાલી છે તારા બોટા સોગંદ ના ખવાય
તું વહાલી છે તારા બોટા સોગંદ ના ખવાય

આજ ચોક પુરાયા માવડી
આજ રમવા આવો માવડી
આજ ચોક પુરાયા માવડી
આજ રમવા આવો માવડી
આવો ને આવો માવડી

BHARAT
lyrics

તારા પાવરીયા રે આયા રમવા વહેલા આવો
તારા જાગરિયા આજ આયા રમવા વહેલા આવો

માડી તું રાખે નજર જો પ્રેમની તો ભાંગે કપરા દુઃખ
એ હેતના દરિયાવાળી જો મારે તું કૂંક તો મળે ટાઢક ને
તારી આ હૂંક જો રે ને હારે તો લાગે છે દૂર
આ દુઃખની બળ બળ બળ ફરતી ડમરીઓ

ને મેં જ્યારે જ્યારે કર્યો સાદ કંકુ કરો હાથ તે ધરિયો
મહિસાસુરનો વધ તે કર્યો
તું મારા કુળની જનેતા રક્ષા કર
બેઠો છું તને હું વિનવું કે હવે આવી ને ચોકમાં પગલાં કર

રાખ કહલ ને જાહો જલાલી તું રાખે
તારા છોરું નું જે કરે બોટું એને આંખે તું રાખે
ને આખો ને આખો તું ચંડમુંડ હુણનારી
મારી રણચંડી ચામુંડ
તું થાબડ થાબડ કરે તો આવી જાય મીઠડી ઊંઘ
તું વહાલનો દરિયો
મારી માવલડી તને જોવા આતુર આખું કુળ

ને વાગે છે પાવા તું આવીને જૂમ જૂમ જૂમ

માંના પાવા વાગે માંના ભુવા ધૂને
માંના પગલાં પડે ટળે દુઝડા
માંના પાવા વાગે માંના ભુવા ધૂને
માંના પગલાં પડે ટળે દુઝડા

માંની આંખ નો પ્રભાવ
માંનો મમતા ફેરો હાથ ફેરે માથે
ભાગી જાય બધા ભૂતડા

માડી વાગે તારા ડાક તારા બાળ ફેરે હાથ
આવે તું તો થઈ જાય ભાગ ઉજળા.

More Lyrics from [Aghori Muzik](#)

BHARAT
lyrics